



**MBV-001-013404**

Seat No. \_\_\_\_\_

**M. A. (Sem. IV) (CBCS) Examination**

April / May - 2018

**Philosophy : ECT - VI**

(*'Many Valued Logic'*)

(*Old Course*)

**Faculty Code : 001**

**Subject Code : 013404**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

1 बहुमूल्यीय तर्कशास्त्रनी ऐतिहासिक पृष्ठभूमि तपासो. 14

**अथवा**

1 व्युकासीविकना श्रीवेल्युड तर्कशास्त्रमां मूणभूत कारकोनी व्याख्या समजावो. 14

2 कलीनेना श्रीवेल्युड तर्कशास्त्रना मूणभूत सत्यताकारको समजावो. 14

**अथवा**

2 कलीनेना श्रीवेल्युड तर्कशास्त्र अनुसार नीचेना विधाननुं सत्यताकोष्टक रथो. 14

$(H \vee R) \rightarrow \sim L$

3 बोश्चरना श्रीवेल्युड तर्कशास्त्रना मूणभूत सत्यताकारकोनी चर्चा करो. 14

**अथवा**

3 बोश्चरना श्रीवेल्युड तर्कशास्त्र अनुसार नीचेना विधाननुं सत्यताकोष्टक करो. 14

$(M.N) > (\sim M \vee L)$

4 व्युकासीविकनां श्रीवेल्युड तर्कशास्त्रनुं अनंत मूल्यीय व्यापकीकरण समजावो. 14

**अथवा**

4 नीचेनां विधानने अनुरूप व्युकासीविकना श्रीवेल्युड तर्कशास्त्र अनुसार सत्यता कोष्टक बनावो.

$\sim P \rightarrow (\sim R \vee \sim S)$

- ૪ નોંધ લખો : (કોઈપણ બે) ૧૪**
- (૧) કલીનેના તર્કશાસ્ત્ર અનુસાર સત્યતાકોષ્ટક બનાવો.  

$$(P \vee Q) \rightarrow (q \vee p)$$
  - (૨) કલીનેના શ્રીવેલ્યુડ તર્કશાસ્ત્રનું અનંતમૂલ્યીય સામાન્યીકરણ.
  - (૩) બોશ્વરનાં તર્કશાસ્ત્ર અનુસાર સત્યતા કોષ્ટક રચો.  

$$(\sim P \vee Q) \rightarrow (P \vee Q)$$
  - (૪) બોશ્વરનાં શ્રીવેલ્યુડ તર્કશાસ્ત્રનું અનંતવેલ્યુડ જનરલાઇઝેન.

## ENGLISH VERSION

- |                                                                                                            |           |
|------------------------------------------------------------------------------------------------------------|-----------|
| <b>1 Explain historical background of many valued logic.</b>                                               | <b>14</b> |
| <b>OR</b>                                                                                                  |           |
| <b>1 Explain the definition of fundamental operators in the Lukasiwick's three valued logic.</b>           | <b>14</b> |
| <b>2 Explain fundamental operators of Kline's three valued logic.</b>                                      | <b>14</b> |
| <b>OR</b>                                                                                                  |           |
| <b>2 Construct truth table of following proposition to the three valued logic of Kline.</b>                | <b>14</b> |
| $(H \vee R) \rightarrow \sim L$                                                                            |           |
| <b>3 Discuss fundamental operators of the three valued logic of Boshwar.</b>                               | <b>14</b> |
| <b>OR</b>                                                                                                  |           |
| <b>3 Construct the truth table of following proposition of the three valued logic of Boshwar.</b>          | <b>14</b> |
| $(M.N) > (\sim M \vee L)$                                                                                  |           |
| <b>4 Explain infinite valued generalization of Lukasiwick's three valued logic.</b>                        | <b>14</b> |
| <b>OR</b>                                                                                                  |           |
| <b>4 Construct the truth table of following proposition according to three valued logic of Lukasiwick.</b> | <b>14</b> |
| $\sim P \rightarrow (\sim R \vee \sim S)$                                                                  |           |
| <b>5 Write short notes : (any two)</b>                                                                     | <b>14</b> |
| (1) Construct truth-table according to Kline's logic.<br>$(P \vee Q) \rightarrow (q \vee p)$               |           |
| (2) Many valued generalization of Kline's three valued logic.                                              |           |
| (3) Construct truth table according to Boshwar's Logic.<br>$(\sim P \vee Q) \rightarrow (P \vee Q)$        |           |
| (4) Many valued generalization of Boshwar's three valued logic.                                            |           |